



સંચાલિત

રાણછોડભાઈ હરજીભાઈ બોધરા સિવિલ સર્વિસ કેન્દ્ર

## GPSC પરીક્ષાની તાલીમ માટેની પ્રવેશ પરીક્ષા પધ્ધતી

પ્રશ્નપત્રની સંખ્યા - 1;	પરીક્ષાનો પ્રકાર - હેતુલક્ષી(MCQ type)
કુલગુણ - 200;	પ્રશ્નોની સંખ્યા - 100(દરેક પ્રશ્નનો 2 માર્ક)
માધ્યમ - ગુજરાતી;	સમય મર્યાદા - 90 મિનિટ
નોંધ : દરેક ખોટા જવાબ માટે, નેગેટિવ માર્કિંગ 0.50 mark રહેશે.	

### અભ્યાસક્રમ

#### (ક) આધુનિક ભારતનો ઇતિહાસ

૧. ૧૮૫૭નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ-ઉદ્ભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્વ, ગુજરાતના વિશેષ સંદર્ભમાં.
૨. ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામજિક સુધારા આંદોલનો.
૩. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતિય ક્રાંતીકારીઓ.
૪. મહાત્મા ગાંધી, તેમના વિચાર, સિદ્ધાંતો, અને જીવન દર્શન, મહત્વના સત્યાગ્રહ - ગુજરાતના ખેડા, બોરસદ, બારડોલી, ધરાસણા, ધોલેરા, રાજકોટ અને લીંબડી સત્યાગ્રહના વિશેષ સંદર્ભમાં.

#### (ખ) સાંસ્કૃતિક વારસો

૧. ગુજરાતી રંગભૂમી : નાટકો, ગીતો, નાટ્યમંડળીઓ.
૨. ગુજરાતી સાહિત્ય : પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો અને સાહિત્ય સંસ્થાઓ
૩. ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો.

## (ગ) ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો.

૧. ભારતીય બંધારણ- આમુખ, મૂળભૂત અધિકારો, અને ફરજો, માર્ગદર્શન સિદ્ધાંતો.
૨. બંધારણીય સત્તાધિકારીઓ: સત્તા, કાર્યો અને જવાબદારી.(રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગવર્નર, મુખ્યમંત્રી, ચૂંટણીપંચ, નાણાપંચ, CAG)
૩. કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો.

## (ઘ) સામાન્ય બૌદ્ધિક ક્ષમતા

૧. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા.
૨. સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ.
૩. સંબંધ વિષયક પ્રશ્નો.
૪. ટકા, સાદુ અને ચક્રવ્યુદ્ધિ વ્યાજ, નફો અને નુકશાન.
૫. સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર.

## (ચ) ભૂગોળ

૧. ભૌતિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં : મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મૌસમી આબોહવાના પ્રદેશો: વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણો, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનીજો.
૨. આર્થિક ભૂગોળ: અર્થતંત્રના મુખ્ય વિભાગો; કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ. પાયાના ઉદ્યોગો – કૃષિ, ખનીજ, જંગલ, ઈંધણ (બળતણ) અને માનવશ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર, પદ્ધતિઓ અને સમસ્યાઓ.

## (છ) પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ- (પરીક્ષા પહેલાના છેલ્લા ત્રણ મહિના માંથી.)

# સુચના

- આગામી સમયમાં ડે.સેક્શન ઓફિસર/ડે.મામલતદારની અને ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ / મામલતદારની પ્રીલીમ પરીક્ષા યોજનાર છે.
- ONLINE ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ મેળવી લેવી અને જ્યારે SMS દ્વારા જણાવવામાં આવે ત્યારે સંસ્થામાં જમા કરાવવી, તેની સાથે સ્નાતક ડિગ્રીની માર્કશીટની સ્વયં પ્રમાણિત ઝેરોક્ષ નકલ, શાળાનું લિવિંગ સર્ટિફિકેટ ની ઝેરોક્ષ નકલ, અને બે ફોટા ફોર્મ સાથે જોડાવાના રહેશે.
- વય મર્યાદા :- 21 વર્ષ (લઘુત્તમ)
- શૈક્ષણિક લાયકાત :- સ્નાતક ડિગ્રી (લઘુત્તમ)
- લેકચરમાં નિયમિત હાજરી જરૂરી છે તથા લેકચર માં અપાતી સૂચના અનુસરવાની રહેશે છે.
- લેકચર ખંડ અને સંસ્થાના પરિસરમાં શાંતિપૂર્વક અને શિસ્તબદ્ધ વર્તવાનું રહેશે.
- વાંચનાલયની સુવિધા ઉપલબ્ધ થઈ શકશે, પરંતુ છાત્રાલય (હોસ્ટેલ) ની સુવિધા મેરીટના આધારે આપવામાં આવશે.
- ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ ની પરીક્ષાની જાહેરાતની સુચીત તારીખ 15/07/2018 અને નાયબ સેક્શન અધિકારી/ નાયબ મામલતદાર વર્ગ-૩ પરીક્ષાની જાહેરાતની સુચીત તારીખ 15/09/2018 છે. આ ટ્રેનીંગ સેન્ટર ખાતે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ જાહેરાત પ્રસિધ્ધ થાય ત્યારે GPSC નુ ફોર્મ અવશ્ય ભરવાનુ રહેશે અન્યથા વિદ્યાર્થીનું એડમિશન રદ ગણાશે.
- રહેવાની વ્યવસ્થા ન થઈ શકે તો દૈનિક રૂ.૧૦૦ લેખે ફક્ત જમવાની વ્યવસ્થા થઈ શકશે.
- સંસ્થાએ બનાવેલ નિયમો નું પાલન કરવું જરૂરી છે.
- એડમિશન માટે પ્રવેશ પરીક્ષા (objective type) લેવામાં આવશે, જેની વિગતવાર જાણ વેબસાઈટ પર તથા SMS દ્વારા કરવામાં આવશે. એડમિશન સંબંધી આખરી નિર્ણય સંસ્થાનો રહેશે.
- ઉપરોક્ત નિયમો માન્ય હોઈ તો જ ONLINE એડમિશન ફોર્મ ભરવું.